

[A-3G]

No. of printed page: 02

SARDAR PATEL UNIVERSITY
T. Y. B. Com. (V Semester) Examination
2016
Tuesday, 18th October
10.00 am - 12.00 pm
UB05CCOM06/15 - Business Finance

કુલ ગુણ : ૬૦

નોંધ : જમણી બાજુના આંક પ્રશ્નના ગુણ દર્શાવે છે.

પ્ર.૧ લીવરેજનો અર્થ સમજાવો. નાણાંકીય નિર્ણયીકરણમાં લીવરેજના મહત્વની ચર્ચા કરો.

(૧૫)

અથવા

પ્ર.૧ શિવમ લી.નું તા.૩૦-૧૨-૧૫ના રોજનું પાકું સરવૈયું નીચે મુજબ છે. :

(૧૫)

ઈકિવેટી શેરમૂડી દરેક રૂ.૧૦નો	૧૦૦૦૦૦	ચોખ્ખી કાયમી મિલકતો	૨૫૦૦૦૦
૧૨% ડિબેન્ચર	૧૨૦૦૦૦	ચાલુ મિલકતો	૮૦૦૦૦
અનામત + વધારો	૪૦૦૦૦		
ચાલુ જવાબદારી	૭૦૦૦૦		
	૩૩૦૦૦૦		૩૩૦૦૦૦

વર્ષ-૨૦૧૫ દરમિયાન કંપનીનું વેચાણ રૂ.૮૦૦૦૦૦ હતું. તેમાં સ્થિર ખર્ચ રૂ.૧૬૦૦૦૦ હતા , જ્યારે ચલીત ખર્ચ વેચાણના ૪૫% હતા. આવકવેરાનો દર ૫૦% છે. ત્રણેય પ્રકારના લિવરેજની ગણતરી કરો.

પ્ર.૨ ટૂંકનોંધ લખો :

(૧૫)

- (અ) શાખનીતિના ઘટકો
- (બ) અ, બ, વર્ગીકરણ
- (ભ) રોકડ રાખવાના ઉદ્દેશો

અથવા

પ્ર.૨ ટૂંકનોંધ લખો :

(૧૫)

- (અ) રોકડ બજેટ
- (બ) આર્થિક વરદી જથ્થો (E.O.Q.)
- (ક) માલસામગ્રીની સપ્લઈઓ

પ્ર.૩ કાર્યશીલ મૂડી એટલે શું ? કાર્યશીલ મૂડીની જરૂરિયાતને અસરકર્તા પરિબલો સમજાવો.

(૧૫)

અથવા

પ્ર.૩ નીચે આપેલ માહિતીના આધારે ઓપરેટિંગ સાચકલ તથા કાર્યશીલ મૂડીની જરૂરિયાત ગણો.

(૧૫)

વિગત	૧-૧-૧૫ (રૂ.)	૩૧-૧૨-૧૫ (રૂ.)
કાચો માલ	૮૦૦૦૦	૧૨૦૦૦૦
ચાલુ કામ	૨૦૦૦૦	૬૦૦૦૦
તૈયાર માલ	૬૦૦૦૦	૨૦૦૦૦
દેવાદારો	૪૦૦૦૦	૪૦૦૦૦
વેતન અને ઉત્પાદન ખર્ચા	----	૨૦૦૦૦૦
વિતરણ અને અન્ય ખર્ચા	----	૪૦૦૦૦
માલસામગ્રી ખરીદી	----	૪૦૦૦૦૦
કુલ વેચાણ	----	૧૦૦૦૦૦૦

(૧) કંપની માલ પૂરો પાડનાર સપ્લાયર્સ પાસેથી ૬૦ દિવસની ક્રેડિટ મેળવે છે.

(૨) બધો જ માલ ઉધાર વેચેલ

પ્ર.૪

(૧૫)

(અ) મૂડી પડતરનો અર્થ સમજાવો. નાણાંકીય સંચાલનમાં તેનું મહત્વ સમજાવો.

(બ) મૂડી પડતરના વિવિધ ખ્યાલો ચર્ચો.

અથવા

પ્ર.૪ તા. ૩૧-૧૨-૨૦૧૫ના રોજનું પાકું સરવૈયું નીચે મુજબ છે.

(૧૫)

	(રૂ.)		(રૂ.)
ઈક્વિટી શેરમૂડી (રૂ.૧૦નો)	૭૦૦૦૦	કાયમી મિલકતો (પડતર કિંમત)	૨૦૦૦૦૦
અનામત	૩૦૦૦૦	બાદ - એકત્રિત ઘસારો	- ૮૦૦૦૦
૧૦% પ્રે. શેરમૂડી (દરેક રૂ.૧૦૦નો)	૨૦૦૦૦	ચોખ્ખી કાયમી મિલકતો	૧૨૦૦૦૦
૧૪% ડિબેન્ચર (દરેક રૂ.૧૦૦નો)	૮૦૦૦૦	ચાલુ મિલકતો	૧૧૦૦૦૦
ચાલુ જવાબદારી	૩૦૦૦૦		
	૨૩૦૦૦૦		૨૩૦૦૦૦

વધારાની માહિતી :

(૧) ઈક્વિટી મૂડી પડતર ૧૬% છે. અનામતોની મૂડી પડતર ઈક્વિટી મૂડી પડતર કરતાં ૧% નીચી છે.

(૨) કંપનીને લાગુ પડતો કરવેરા દર ૬૦% છે.

(૩) સરેરાશ બજાર કિંમત નીચે મુજબ છે. :

ઈક્વિટી શેર - ૧૬, પ્રેક. શેર-૭૦, ડિબેન્ચર-૮૦

ગણો :

(૧) ચોપડે મૂલ્યના આધારે ભારીત સરેરાશ મૂડી પડતર.

(૨) બજાર મૂલ્યના આધારે ભારીત સરેરાશ મૂડી પડતર.

